

પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાત અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કપાસના
પાકમાં પાક સંરક્ષણ વિષય ઉપર વેબીનાર યોજાયો

પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાત અને આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે તેમજ નાહેપ કાસ્ટ, આઈએબીએમઆઈ કોલેજ, આકૃયુ, આણંદના સહયોગથી તા. ૧૬-૦૯-૨૦૨૦ના રોજ “કપાસના પાકમાં પાક સંરક્ષણ” વિષય ઉપર એક દિવસીય રાજ્ય કક્ષાના વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. આ વેબીનારમાં કુલ ૧૦૪૨ જેટલા ખેડૂતો, વૈજ્ઞાનિકો, અધિકારીઓ, વિસ્તરણ કાર્યકરો તથા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ જ્યારે આશરે ૩૫૦૦ જેટલા લોકોએ યુ ટ્યુબ ઉપર જીવંત પ્રાસારણ નિહાળેલ છે.

આજના વેબીનારની શરૂઆતમાં પીપીએજીના ઝોનલ કો-ઓર્ડિનેટર ડૉ. આર.જી. પરમારે આ વેબીનારમાં જોડાયેલ સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું. ડૉ. જી. જી. પટેલ, પ્રમુખશ્રી, પીપીએજી દ્વારા વેબીનારનો પરીચય અને પીપીએજી શું છે અને ખેડૂતો માટે શું શું કાર્ય કરે છે તે અંગેની રૂપરેખા આપી.

આજના વેબીનારમાં ઉદઘાટક અને અધ્યક્ષ તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ આર.વી વ્યાસ સાહેબે જણાવ્યું કે કપાસ કે જે સફેદ સોના તરીકે ઓળખાય છે અને આપણા જીડીપીમાં તેનું મહત્તમ યોગદાન છે વધુમાં તેઓએ જણાવેલ કે માન. પ્રધાનમંત્રીશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સોલાર લાઇટ ટ્રેપ, ફેરોમેન ટ્રેપ જેવા ઓછા ખર્ચે જીવાત નિયંત્રણ થાય તેવા ઉપાયો કરવા પડશે. ડૉ. પ્રભાતકુમાર, નેશનલ કોઓર્ડિનેટર, નાહેપ કાસ્ટ આઇસીએઆર, નવી દિલ્લીએ જણાવેલ કે કપાસ એ ખૂબ જ જૂનો પાક છે અને તે લોકોને રોજી, રોટી અને કપડા પૂરો પાડતો અગત્યનો રોકડીયો પાક છે કપાસ ઉગાડતા ખેડૂતોના પાક સંરક્ષણના પ્રશ્નોના નિરાકરણ અર્થે વેબીનારનું આયોજન કરવા બદલ પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાતને અભિનંદન પાઠવેલ. ડૉ. પી. આર. વૈષ્ણવ, આચાર્ય, બીએસીએ આકૃયુ, આણંદે હાલની કોવીડ-૧૯ની મહામારીમાં ખેડૂત સભાઓનું આયોજન થઈ શકે તેમ ન હોઈ ખેડૂતોને તેમની ખેતીમાં પાક ઉત્પાદનના અવરોધક પરિબળો પૈકી રોગ જીવાત મુખ્ય છે. રોગ જીવાતથી પાકનું ઉત્પાદન ઘટે છે સાથે સાથે ગુણવત્તા પણ બગડે છે જેથી આર્થિક ખોટ જાય છે. તેથી ખેડૂતોને રોગ જીવાત - નિયંત્રણ અંગે ઘરે બેઠા માર્ગદર્શન મળી રહે તે હેતુથી કપાસના પાકમાં પાક સંરક્ષણ” વિષય ઉપર વેબીનારનું આયોજન થયેલ છે તે ખૂબ જ આવકારદાયક છે. વધુમાં તેઓએ ખેડૂતોને આ વેબીનારનો મહત્તમ લાભ લેવા આહવાન કરેલ. આ વેબીનારમાં ડૉ. એચ આર. દેસાઈએ કપાસની ચુસિયા પ્રાકારની જીવાતો અને તેનું સંકલિત જીવાત વ્યવસ્થાપન વિષય ઉપર પોતાનું વ્યાખ્યાના રજૂ કર્યું હતું. ડૉ. આર. કે. કુમરે ગુલાબી ઇયળ અને તેનું સંકલિત વ્યવસ્થાપન. ડૉ. એ. જી. દેસાઈએ કપાસના રોગો અને તેનું સંકલિત નિયંત્રણ વિષય ઉપર જ્યારે

ડો. બી. ડી. પટેલે કપાસમાં નિંદણ વ્યવસ્થાપન વિષય ઉપર પોતાનું વ્યાખ્યાના રજૂ કર્યું હતું. ડો. એમ. એફ. આચાર્યએ કૃષિ રસાયણોની પસંદગી અને તેની કાર્યક્ષમતા વધારવાના ઉપાયો જ્યારે ડો. આર. એલ. કલસરીયાએ જંતુનાશકોનો વિવેકપૂર્ણ ઉપયોગ વિષય ઉપર ચર્ચા કરી હતી. પીપીએજી, આણંદ ઝોનના સર્વે કારોબારી સભ્યશ્રીઓ પણ આ વેબીનારમાં પ્રત્યક્ષ હાજર રહેલ. આ વેબીનારનું સમગ્ર સંચાલન ડો. ડી. બી. સિસોદીયા, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું. અંતમાં આભાર વિધિ ડો. બી.એચ.પટેલ, મહામંત્રી, પીપીએજી દ્વારા કરવામાં આવેલ અને વેબીનાર પૂર્ણ જાહેર કરેલ હતો.

